

	MONDAY	TUESDAY	WEDNESDAY	THURSDAY	FRIDAY
અઠવાડિયું1 એપ્રિલ 16 મે7 જુન4 જુન 25 જુલાઈ16 સપ્ટેમ્બર17 ઓક્ટોબર 8	બેક કરેલા સોસેજ રોલ ટમાટો રેલીશ(ટામેટાની ચટણી) મેશ પોટેટો (બટાકાનો છુંદો)	રોસ્ટ બીફ(ગાયનું માંસ) અને ચોર્કશાયર પુર્ડિંગ(મેંદો,ઈંડા અને દુધ ની કેક જેવી વાનગી)	બાર્બેક્યુ ચિકન ફિલેટ (બાર્બેક્યુ કરેલા મરઘી ના ટુકડા) હર્બી ઓવનબેફ બટાકા ના ટુકડા	સ્વીટ ચીલી તુર્કીરાઇસ (ગળ્યા મરચા વાળો તુર્કીશ ભાત)	બેક કરેલ ફીશ ફિંગર (ફીશની ચીપ્સ)અનેટમાટો કેચપ વાળી ચીપ્સ
	શક્કરિયા અને દાળ નું શાક નાન ભાત	કોર્ન નગેટ્સ (વીગન)	પીઝા	વેજીટેરીઅન સોસેજ અને ગ્રેવી (રસો)	વેજીટેબલ લસાનીઆ (વણેલા પડ માં શાક અને ટામેટા વિ.) ગાર્લિક બ્રેડ (લસણવાળો બ્રેડ)
	સ્વીટકોર્ન (મકાઈ) લીલાવટાણાં	રોસ્ટપોટેટો (શેકેલા બટાકા) બ્રોકોલી, ગાજર અને ફલાવર મીશ્રણ (મિક્સ) રસાવાળું (ગ્રેવી)	મકાઈ વટાણા	બ્રોકોલી ફલાવર	બેક્ડ બીન્સ વટાણા
	આઈસ્ક્રીમ, સ્મૂધી સફરજન લોલી	નાના બીસ્કીટ અને સમારેલા ફળ	ફળ ફ્રેપ્પેજ (ફ્રાયફ્રુટ ઓટ, યાસણી વિ થી બનાવેલ બિસ્કિટ જેવું)	જેલી, એંજલ ડીલાઈટ (દૂધથી બનાવેલું આઈસ્ક્રીમ જેવું મીક્સ), દહીં, તાજાફળ	લીંબુ વાળું મકિન(કેક)
Week 2 એપ્રિલ 23 મે 14 જુન 11 જુલાઈ 2 સપ્ટેમ્બર23 સપ્ટેમ્બર24 ઓક્ટોબર15	બીફ બોલોંગનીઝ પાસ્તા બેક, લસણવાળાબ્રેડ ની સળીઓ	રોસ્ટ ચિકન(મરઘી) અને રસો શેકેલા બટાકા	વેજીટેબલ તગેઇન જ્વેલડ પુશપુશ (રવા સાથે વેજીટેબલ્સ- ઉપમા જેવું)	મરઘી (ચિકન), વેજીટેબલ અને બટાકા બેક	ખીરું ચડાવી તળેલી માછલી અને ટમેટો કેચઅપ, ચિપ્સ
	પડવાળા વેજીટેબલ (ખારા બિસ્કિટ જેવા) મેશ પોટેટો (બટાકા નો છુંદો)	બ્રોકોલી અને ફલાવર બેક કરેલું ટમેટાનો બ્રેડ મેયોનેઝ (એગચોક, તેલ અને વિનેગર નાખેલું છીણ જેવું સલાડ)	પીઝા	ઇટાલિયન ટમેટા વાળા પાસ્તા ગાર્લિક બ્રેડ ની સળીઓ (લસણવાળો બ્રેડ)	રોટલી માં વીટેલું ફલાફલ (દાળવડા) ઉપર ટામેટા અને સાથે મિક્સ સલાડ
	તણ જાતના વેજીટેબલ્સ અને બેક્ડ બીન્સ	ગાજર ના પીતા અને લીલા તાજા કઠોળ	લીલા તાજા કઠોળ અને મકાઈ	બ્રોકોલી અને ગાજરની ચીપ્સ	લીલા વટાણા, મકાઈ અને સાથે મીક્સ ઘોલર મરચા (કેપ્સિકમ)
	આઈસ્ક્રીમ, સ્મૂધી સફરજન લોલી	નાના બીસ્કીટ અને સમારેલા ફળ	ગાજરની કેક	જેલી, એંજલ ડીલાઈટ (દૂધથી બનાવેલું આઈસ્ક્રીમ જેવું મીક્સ), દહીં, તાજાફળ	ચોકલેટ અને ઓટ ના ફૂડી બિસ્કીટ
Week 3 એપ્રિલ 30 મે 21 જુન 18 જુલાઈ 9 સપ્ટેમ્બર10 ઓક્ટોબર 1	કરકરું ખીરું ચડાવેલી સાલ્મન માછલી - આજના બટાકા	ભૂંડનું રોસ્ટેડ માંસ શેકેલા બટાકા	ખાટુ મરઘી નું શાક, નાન, ભાત	બેક કરેલા ભૂંડના સોસેજ , બટાકાના ઉભા મસાલા વાળા ટુકડા	બેક કરેલી માછલી ની ચીપ્સ અને ટમેટો કેચઅપ ચીપ્સ
	મેકોની ચીઝ, લસણવાળો બ્રેડ	બેક કરેલા ફુઓર્ન ટમેટો પાસ્તા	પીઝા - મેયોનેઝ (એગચોક, તેલ અને વિનેગરનાખેલું છીણ જેવું સલાડ)	પાસ્તાસાથે ટમેટો સોસમાં વેજીટેરીયન ડબકા - લસણવાળા બ્રેડની સળીઓ	લાલદાળનું ફલાન નવા બટેટા
	લીલાવટાણા	લીલાવટાણા બ્રોકોલી, ગાજરઅને ફલાવર નું મિક્સ	લીલા કઠોળ ગાજરના પીતા	બ્રોકોલી ગાજર	બેક કરેલા બીન્સ અને વટાણા
	આઈસ્ક્રીમ, સ્મૂધી સફરજન લોલી	નાના બીસ્કીટ અને સુધારેલા ફળ	બ્રાઉની (ચોકોલેટી કેક)	જેલી, એંજલ ડીલાઈટ (દૂધથી બનાવેલું આઈસ્ક્રીમ જેવું મીક્સ), દહીં, તાજાફળ	ચીઝ અને એપલ ના ઉભા સમારેલા ટુકડા

પ્રાથમિક મેનુ - એપ્રિલ - ઓક્ટોબર 2018

આ ઉપરાંત બ્રેડ અને ઋતુ પ્રમાણે ના સલાડ પીરસવામાં આવશે

આ સાથે તાજા ફળ, ફળનો વાડકો, ઓર્ગેનિક દહીં, ભાતનો વાડકો, ચીઝ અને બિસ્કિટ દરરોજ મળશે